CIN: L16000GJ1955PLC067605 Regd. Office: At Darijpura Post - Amaliyara, Vadodara - 390022, Gujarat Ph: 0265 2540281. Fax: 0265 2541700, Email: share@goldentobacco.in Website:www.goldentobacco.in

NOTICE OF 65th ANNUAL GENERAL MEETING, E-VOTING INFORMATION AND BOOK CLOSURE

NOTICE is hereby given that:

1. The 65th Annual General Meeting ('AGM') of the Company will be held on Thursday, September 30, 2021, at 11:00 A.M. at Banyan Paradise Resort, Near Dumad Road, Vemali, Vadodara - 390008, Gujarat.

2. Pursuant to provisions of section 91 of the Companies Act, 2013 and as required under regulation 42 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the register of members and share transfer books will remain closed from September 24, 2021 to September 30, 2021 (Both Days inclusive) for the purpose of 65th AGM of the Company

3. Electronic copy of the Annual Report is available on the website of the Company at www.goldentobacco.in . Annual report has been sent to all the other members at their registered address in the permitted mode. The dispatch of the annual report has been completed on September 6, 2021.

4. Members holding shares either in physical form or dematerialized form, as on the cut-off date **September 23, 2021**, may cast their vote electronically on the business as set forth in the notice of the AGM through electronic voting system of Central Depositories Service Limited ("CDSL") from a place other than the venue of the AGM. All the members are hereby informed that:

i. The business as set forth in the notice of the AGM may be transacted through voting by electronic means;

The e-voting shall commence on Monday, September 27, 2021 (9.00 a.m.

iii. The e-voting shall end on Wednesday, September 29, 2021 (5:00 p.m. IST); iv. The cut-off date for determining the eligibility to vote by electronic means or at the AGM is Thursday, September 23, 2021;

Wednesday, September 29, 2021 and e-voting shall not be allowed beyond the said time: vi. Any person who becomes the member of the Company after dispatch of the annual report and holding shares as on the cut-off date may obtain User ID and

The e-voting module shall be disabled by CDSL after 5:00 p.m. on

Password by referring to the e-voting instructions in the notice which is available on the Company's website www.goldentobacco.in and the website of CDSL www.cdslindia.com. vii. Members who have cast their vote through e-voting may attend the meeting

but will not be entitled to vote again at the meeting. The facility of voting

through ballot paper shall be made available to the members attending the meeting who have not cast their vote through e-voting. 5. In case of any queries, you may refer the Frequently Asked Questions (FAQs) section of www.evotingindia.com or contact CDSL, 17th Floor, Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Mumbai-400001 or at Toll Free No 18002005533, Email ID

helpdesk.evoting@cdslindia.com Members may also write to the under signed at the above mentioned address or e-mail at share@goldentobacco.in By order of the Board For Golden Tobacco Limited

Date: September 7, 2021 Place: Vadodara

यूनियन बैंक 🕼 Union Bank

1 Angles Expension

Ring road Branch (E-ANDHRA) Tulsi Market, Nr. Rushabh Petrol Pump, Ring Road, SURAT-395002. Tel: 0261-2302360, 2368571, E-mail: bm1118@unionbankofindia.co

DEMAND NOTICE (UNDER SUB-SECTION (2) OF SECTION 13 OF THE SARFAESI ACT, 2002)

f. No.111830100005039

Mr. Alpeshbhai R Kathiriya (Applicant) & Mr. Jatinbhai Kathiriya (Co-applicant)
16-A, Sarita Sagar Society, Nana Varachha, Present Residential Address Varachha, Surat-395010
Mr. Lakhanlalji R. Lathiyya(Guarantor)
95-96 Bhaguraj Nagar, Nana Varachha, Surat - 395006

95-96 Briaguraj Nagar, Naria Varacinia, Surat - 550000
Dear Sir/Madam,
SUB: Enforcement of Security Interest Action Notice — In connection with the Credit
facilities enjoyed by Mr.Alpeshbhai R Kathiriya (Applicant) & Mr. Jatinbhai
Kathiriya (Co-applicant) with our (UBI E-Andhra Bank) Branch - Classified as NPA We have to inform you that your account Mr.Alpeshbhai R. Kathiriya (Applicant) & Mr. Jatinbhai Kathiriya (Co-applicant) has been classified as NPA account pursuant to default in making repayment of dues/ installments/ interests. As on 01.04.2021, a sum of Rs. 16,94,269.47/-(Rupees Sixteen lakhs ninety four thousand two hundred

sixty nine and forty seven paisa only) is outstanding in your account as shown below. Nature of facility Loan Sanctioned Date of (in Rs.) Rate of Interest Housing Loan 16,50,000.00/- 01/04/2021 8.50% Rs.16,94,269.47/-

In spite of our repeated demands, you have not paid any amount towards the amount outstanding in the account and you have not discharged the liabilities. We do hereby call upon you in terms of Section 13 (2) of the Securitization and Reconstruction of Financial Assets and enforcement of Security Interest Act, 2002, to pay a sum of Rs. 16,94,269.47/-(Rupees Sixteen lakhs ninety four thousand two hundred sixty nine and forty seven paisa only) together with interest calculated at the contractual

rate with monthly rest as per the terms and conditions of loan documents executed by you and discharge your liabilities in full within 60 days from the date of receipt of this notice, failing which, we shall be constrained to enforce the following securities created by you in favour of the bank by exercising any or all of the rights given under the said Act. DETAILS OF THE SECURED ASSETS:
All the right, title and interest on property bearing Flat No. 402 (on 4th Floor) adm Roy.23 Sq.fts. with proportionate undivided inchoate share, of land below in building known as Shukan Residency Building No. E, with all appurtenances pertaining thereto, standing on land bearing R.S.No. 78, Block No. 81, T.P. Scheme No.18, F.P. No. 37 (Old F.P.28) lying being & situated at Vill.: Mota varachha, Dist .: Surat, Sub Dist .: Choryasi.

Please note that if you fail to remit the dues within 60 days and if Bank exercises all its rights under this Act and if the dues not fully satisfied with the sale of proceeds of the rights under this Act and in the does not not support with the same of proceeds of the secured assets, we shall be constrained to take appropriate legal action against you in a Court of Law/ Debt Recovery Tribunal for recovery of the balance amount from you. We do hereby, by this notice invite your attention to provisions of sub-section (8) of Section 13 of the Act, in respect of time available to you, to redeem the secured assets.
 As per Sec 13(13) of the Act, on receipt of this notice you are restrained from disposing of or dealing with the above securities except in the usual course of business without the consent of the Bank. Please note any violation of this section entails serious consequences.

Yours Faithfully,

Yours Faithfully, Authorized Officer, Union Bank of India Date - 18/06/2021 | Place - Surat

यूनियन बैंक 🕼 Union Bank

1 Angles Ring road Branch (E-ANDHRA)
Tulsi Market, Nr. Rushabh Petrol Pump, Ring Road, SURAT-395002.
Tel: 0261-2302360, 2368571, E-mail: bm1118@unionbankofindia.co

Date: 18/06/2021

DEMAND NOTICE (Under Sub-Section (2) of Section 13 of the Sarfaesi act, 2002)

Ref. No 111830100008267

Mr. Rakesh D Kanet (Applicant) & Gopal D Kanet (Co-Applicant) Plot No 23, Ramvatika-1,Nr Rangoli Chowk,velanja, 394150, Surat Mr. Radadiya Durlabhbhai (Guarantor)

243, Shyam Dham Society, Part-01, Puna Simada Road, Surat 394150 Jear Sir/Madam, SUB: Enforcement of Security Interest Action Notice – In connection with the Credit

facilities enjoyed by Mr. Rakesh D Kanet (Applicant), Gopal D Kanet (Co-Applicant) o bur (UBI E-Andhra Bank) Branch - Classified as NPA We have to inform you that your account Mr. Rakesh D Kanet (Applicant), Gopal D

Kanet (Co Applicant) has been classified as NPA account pursuant to default in making repayment of dues/ installments/ interests. As on 18.04.2021, a sum of Rs. 6.25.478.49/- (Rupees Sixteen lakhs twenty five thousand four hundred seventy eight and forty nine paisa only) is outstanding in your account as shown below.

Nature of facility Loan Sanctioned (in Rs.) Date of NPA Total dues (in Rs.) Housing Loan | 17,00,000.00/- | 18/04/2021 | 7.25% 16,25,478.49/n spite of our repeated demands, you have not paid any amount towards the amoun

outstanding in the account and you have not discharged the liabilities. We do hereby call upon you in terms of Section 13 (2) of the Securitization and Reconstruction of Financial Assets and enforcement of Security Interest Act, 2002, to pay a sum of Rs. 16,25,478.49/- (Rupees Sixteen lakhs twenty five thousand four hundred seventy eight and forty nine paisa only) together with interest calculated at the contractual rate with monthly rest as per the terms and conditions of loan documents executed by you and discharge your liabilities in full within 60 days from the

date of receipt of this notice, failing which, we shall be constrained to enforce the following securities created by you in favour of the bank by exercising any or all of the

rights given under the said Act.

DETAILS OF THE SECURED ASSETS:

For Construction Of House -plot No 54,kamdhenu Residency, R.s.no 172, 173, 174, block No.213/a, velanja, kamrej, Surat Adm 40.15 Sq Mtrs. total Area G+1 Is 907 Sq Fts. . Please note that if you fail to remit the dues within 60 days and if Bank exercises all its rights under this Act and if the dues not fully satisfied with the sale of proceeds of the secured assets, we shall be constrained to take appropriate legal action against you in a Court of Law/Debt Recovery Tribunal for recovery of the balance amount from you We do hereby, by this notice invite your attention to provisions of sub-section (8) or Section 13 of the Act, in respect of time available to you, to redeem the secured assets. As per Sec 13(13) of the Act, on receipt of this notice you are restrained from disposing of or dealing with the above securities except in the usual course of business without the consent of the Bank. Please note any violation of this section entails serious consequences.

Yours Faithfully, Authorized Officer, Union Bank of India Date - 18/06/2021 | Place - Surat

यूनियन बैंक 🕼 Union Bank

Ring road Branch (E-ANDHRA)

10, Mr. Singanporiya Dhaval N. (Applicant) & Mr. Dharmesh R Singanporiya (Co-Applicant) 7-4794, KH Mandir Street Chidiakui Begampura, b/h Torrent Power Surat, Surat 395003 Mrs. Gohil Manishakumari (Co-Applicant) Plot No 23, Ramvatika-1,Nr Rangoli Chowk, Velanja-394150

Dear SIT/Madam,
SUB: Enforcement of Security Interest Action Notice – In connection with the Credit facilities enjoyed by Mr. Singanporiya Dhaval N. (Applicant), Mr. Gohil Manishakumari (Co-Applicant), Mr. Dharmesh R Singanporiya (Co-Applicant) with our (UBI E-Andhra Bank) Branch - Classified as NPA

We have to inform you that your account Mr.Singanporiya Dhaval N.(Applicant) Mr.Gohil Manishakumari(Co-Applicant), Mr.Dharmesh R Singanporiya(Co-Applicant) has been classified as NPA account pursuant to default in making

Nature of facility Loan Sanctioned Date of (in Rs.) Rate of

Rs.18,93,370/-

spite of our repeated demands, you have not paid any amount towards the amoun utstanding in the account and you have not discharged the liabilities. /e do hereby call upon you in terms of Section 13 (2) of the Securitization and econstruction of Financial Assets and enforcement of Security Interest Act, 2002, to pay sum of Rs.18,93,370/- (Rupees Eighteen lakhs ninety three thousand three hundred seventy only) together with interest calculated at the contractual rate with monthly rest as per the terms and conditions of loan documents executed by you and discharge your liabilities in full within 60 days from the date of receipt of this notice, failing which, we shall be constrained to enforce the following securities created by you in favour

For Purchase Of Flat No A/102 On 1st Floor Of Siddhi Tower Of Samarth Park Rs No 625/1+2 Tps No. 12 F.P.No. 85, Adajan Choryasi Surat

a Court of Law/ Debt Recovery Tribunal for recovery of the balance amount from you We do hereby, by this notice invite your attention to provisions of sub-section (8) o Section 13 of the Act, in respect of time available to you, to redeem the secured assets

As per Sec 13(13) of the Act, on receipt of this notice you are restrained from disposing of or dealing with the above securities except in the usual course of business without the consent of the Bank. Please note any violation of this section entails

Date - 18/06/2021 | Place - Surat Authorized Officer, Union Bank of Indi

SD/-Pawan Kumar Malsaria Whole-time Director & CFO

The Federal Bank Ltd.,

Address: 134, 13th Floor, Jolly Maker Chambers No. 2, Nariman Point, Mumbai 400 021

FEDERAL BANK

//SPEED POST with A/D//

Loan Collection & Recovery Department / Mumbai Division

1. Mr. Rajeshkumar Jain, aged 45 years S/o Bhanwarlal Jain, Proprietor of Light Home, residing at 148, Gayatri Nagar, B/h Maruti Nagar, Kholvad, Surat, Guiarat – 394190 Light Home a proprietorship firm of Mr. Rajeshkumar Jain having its office at Shop no. 24, Shrushti complex, Kamrej

Char Rasta, Kamrei, Surat, Guiarat - 394185 2 Mrs. Rekhaben R Jain, aged 45 years, W/o Rajeshkumar Jain, residing at 148, Gayatri Nagar, B/h Maruti Nagar,

Kholvad, Surat, Gujarat – 394190

Notice issued under section 13(2) of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (hereinafter referred to as Act)

You have availed following loan facilities from The Federal Bank Limited a company registered under the Companies Act having registered office at Alwaye (hereinafter referred to as the bank) through its branch at Kamrej after executing necessary security agreements / loan documents in favour of the Bank.

Sr. No	Nature of Loan / Account No.	Amount	Date of disbursement	Parties	
1	Cash Credit / 18475500000058	Rs.95,00,000.00	01/10/2016	1st of you as principal borrower and 2nd of you as coobligant	
2	Demand Loan / 18476900000102	Rs.15,00,000.00 10/04/2018		1st of you as principal borrower and 2nd of you as coobligant	
3	GECL Term Loan / 18476900000151	Rs.18,50,000.00	12/06/2020	1st of you as principal borrower and 2nd of you as coobligant	
4	FITL (Covid Moratorium) / 18476900000185	Rs.5,43,746.00	05/09/2020	1st of you as principal borrower and 2nd of you as coobligant	
5	Housing Loan / 18477300000429	Rs.13,50,000.00	21/04/2016	1st of you as principal borrower and 2nd of you as coobligant	

Towards the security of the aforesaid credit facilities no 1, 2, 3 and 5 availed from the Bank, the 1st and 2nd of you has favour d immovable and/or movable properties.

Description of Hypothecated Movable Properties for credit facilities nos. 1 to 3

Hypothecation entire stock and book debts of M/s Light Home.

Description of Mortgaged Immovable Properties for credit facilities nos. 1 to 3 All that piece and parcel of Unit no. 44, admeasuring 504.00 sq. ft., on ground floor, of "A" type building together with

undivided proportionate share in the land underneath the building of complex known as Bhavani Complex, situated on land bearing Revenue block no. 101/A paikee of Mouje: Navagam, Taluka: Kamrej, Dist: Surat, Bounded in East by A Type Unit no. 30, West by Open space of chowk, North by A Type Unit no. 43 and South by A Type Unit no. 45.

Description of Mortgaged Immovable Properties for credit facilities nos. 1 to 3 & 5 All that piece and parcel of Plot no. 130 as per approved plan i.e. Plot no. 148 on site of Gayatinagar, situated on the land

bearing Block no. 467 & 472 of Mouje: Kholwad, Taluka: Kamrej, Dist: Surat, Bounded in East by Plot no. 139, West by 20 sq.ft Road, North by Plot no. 149 and south by Plot no. 147. The aforesaid hypothecated/ mortgaged security properties are hereinafter referred to as 'secured assets'. You have

defaulted repayment of the above-secured debt in violation of the agreed terms and the account became a Non Performing Asset, as per the guideline of RBI. The undersigned being Authorised Officer of the Federal Bank Ltd. hereby informs you that a total a sum of

₹ 1,37,27,632.29 (Rupees One Crore Thirty Seven Lakh Twenty Seven Thousand Six Hundred Thirty Two and Paisa Twenty Nine only) plus cost is due from you jointly and severally as per details mentioned below, under your loan accounts with Kamrej branch of the Bank.

Sr. No	Branch	A/c No.	Balance O/s Rs.	Interest Rate from	NPA Date
1	Kamrej	18475500000058	1,00,79,983.29	17.05% p.a. with monthly rests from 01/05/2021	30/03/2021
2	Kamrej	18476900000102	5,00,425.00	14.20 % p.a. with monthly rests from 10/05/2021	30/03/2021
3	Kamrej	18476900000151	19,22,249.00	11.25 % p.a. with monthly rests from 12/05/2021	30/03/2021
4	Kamrej	18477300000429	12,24,975.00	9.95 % p.a. with monthly rests from 21/05/2021	22/04/2021

As such, the bank as a secured creditor as envisaged under section 2(zd) of the Act hereby call upon you, as contemplated under Sec. 13 (2) of the said Act, to pay the said amount with further interest thereon till the date of payment and costs/other charges within 60 days from the date of this notice, failing which the Bank as a secured creditor shall be constrained, without prejudice to any of its other rights and remedies, to take, without any further notice, the following recourse measures prescribed under section 13(4) of the Act against you.

1.To take possession of the secured assets described above and transfer the said assets by way of lease, assignment or sale for realising the dues.

2. To take over the management of the secured assets and transfer them by way of lease, assignment or sale for realising

3. To appoint any person to manage the secured assets the possession of which has been taken over by the bank.

4.To require at any time by notice in writing, to any person who has acquired any of the secured assets from you and from whom any money is due or may become due to you, to pay to the bank.

You are also put on notice that as per section 13(13) of the Act, you shall not after receipt of this notice transfer by way of sale, lease or otherwise any of the secured assets referred to in this notice in any manner whatsoever to the prejudice of the interest of the bank without its prior written consent.

You are also put on notice that Section 13(6) of the Act empowers the bank to give a valid title to the transferee all rights in, or in relation to, the secured asset transferred as if the transfer had been made by the owner of such secured asset. Please be informed that in the event of your failure to discharge your liability in full within 60 days from the date of this notice and the bank initiates remedial actions under the provisions of the Act, you shall further be liable to pay to the bank all cost, charges and expenses incurred in that connection. Your attention is also invited to the provisions of section 13 (8) of the Act, in respect of time available, to redeem the secured assets (security properties). In case the dues are not fully satisfied

with the sale proceeds of the secured assets, the bank shall proceed against you for the recovery of the balance amount personally. This notice is issued without prejudice to the other rights and remedies available to the bank for recovering its dues. For, The Federal Bank Ltd. Lecin C Asst. Vice, President & Branch Head LCRD/Mumbai Division

Dated this the day 29th day of May 2021

(Authorised Officer under SARFAESI Act)

RELIANCE HOME FINANCE LIMITED

Near Ellis Bridge Police Station, Ashram Road, Ahmedabad-380006

Registered Office: - Reliance Home Finance Ltd., Ruby Tower, 11th floor, North West wing, Plot No.29, J.K Sawar Marg, Dadar Mumbai 400 028

DEMAND NOTICE

Whereas the borrowers/co-borrowers/mortgagors mentioned hereunder had availed the financial assistance from Reliance Home Finance Ltd. We state that despite having availed the financial assistance, the borrowers juarantors / mortgagors have committed various defaults in repayment of interest and principal amounts as per due lates. The account has been classified as Non Performing Asset on the respective dates mentioned hereunder, in the books of RHF in accordance with the directives relating to asset classification issued by the National Housing Bank, consequent to the Authorized Officer of Reliance Home Finance Ltd. under Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 & in exercise of powers conferred under Section 13(12) read with Rule 3 of Security Interest (Enforcement) Rules, 2002 issued Demand Notices on respective dates mentione erein below under Section 13(2) of SARFAESI Act, 2002 calling upon the following borrowers /guarantors /mortgagors o repay the amount mentioned in the notices together with further interest at the contractual rate on the amoun entioned in the notices and incidental expenses, cost, charges etc until the date of payment within 60 days from the date of receipt of notices.

The notices issued to them on their last known addresses have returned un-served and as such they reby informed by way of public notice about the same.

Name of Borrower/Co-Borrower/Guarantor

1] Yogeshkumar Ambalal Soni 2] Chhayaben Yogeshkumar Soni 1 Patel Vas Opp Bank Of Baroda At Unava Gandhinagar Gujarat

LAN: RHAHAHM000035128 & RHATAHM000036046 NPA Date: 23rd March,2021 Date of Demand Notice : 19th July,2021 Outstanding Amount As per 13(2) Notice: Rs.26,59,833/-

Property Address of Secured Assets All that piece and parcel of immovable property bearing property situated at Flat No.A/103 admeasiromg 163.03 Sq.Mtrs. (Super Built Up Area), First Floor, "Radhika Residency", Survey No.79/2, Final Plot No.75/2 Town Planning

heme No.16, Mouje, Pethapur, Taluka Gandhinagar, District Gandhinagar Registration, Sub District Gandhinagar. Name of Borrower/Co-Borrower/Guarantor : Rakeshkumar Bharatbhai Panchal 2] Hansaben Bharatbhai Panchal 3] Nirav Bharat Panchal

Block L 403 Soriam Greens B/S Dharti States New R T O Roadahmedabad Gujarat-382418 LAN: RHAHAHM000061043 NPA Date: 23rd March,2021 Outstanding Amount As per 13(2) Notice: Rs.17,04,492/-

Property Address of Secured Assets
"All that piece and parcel of immovable property being FLAT NO.C-11 on 2nd Floor, having area adm.45.15 Sq.Mtrs Built -Up alongwith undivided share in the land adm.30.57 in the scheme known as "CHAHAT RESIDENCY" a scheme constructed on freehold Non-Agricultural land bearing Survey No.945/2 paiki adm.6949 Sq.Mtrs. being Final Plo

No.80/2 adm.4169 Sq.Mtrs. of Town Planning Scheme No.106 of Mouje VASTRAL Taluka Vatva in the Dist. o medabad and Registration Sub District Ahmedabad 12 (NIKOL) within the State of Gujarat" 3. Name of Borrower/Co-Borrower/Guarantor : 1] Hitesh Rameshbhai Bhatt 2] Rameshbhai A Bhatt 3] Kailasben Rameshbhai Bhatt

- 29, Amarnath Tenament, Sureliya Road, Amraiwadi Ahmedabad I AN - RHAHAHM000018053 NPA Date: 23rd March, 2021 Date of Demand Notice : 27th July 2021 Outstanding Amount As per 13(2) Notice: Rs.17,60,406/-

Property Address of Secured Assets

"All that piece and parcel of immovable property bearing property sitauted at Flat No.D-103 admeasuring 122 Sq.Yrds Vrundavan Vatika, Survey No.889 Paiki Sub Plot No.2, Town Planning Scheme No.106 (Vastral - Ramol), Final Plot No.27, Mouje Vastral, Taluka Dascroi, District Ahmedabad, Registration Sub District Ahmedabad - 12 (Nikol)"

Name of Borrower/Co-Borrower/Guarantor

1] Snehalbhai Jayantilal Vyas 2] Urmilaben S Vyas A/104 Sagar Tenament Naroda Kathvada Road Naroda Ahmedabad

LAN : RHAHAHM000046546 NPA Date: 23rd March,2021

Outstanding Amount As per 13(2) Notice: Rs.9,14,761/-**Property Address of Secured Assets**

'All that piece and parcel of immovable property bearing property situated at FLAT NO. D- 207, SECOND FLOOR, SHYAM KUTIR- 2, NR DASTAN CIRCLE, OFF SP RING ROAD, NARODA, Naroda I E having Block No.82/B/1 being Final Plot No.59/2 paiki admeasuring 2856 Sq.Mtrs. & Block No.82/B/2 being Final Plot No.59/2 Paiki admeasuring 2856 Sq.Mtrs. Of TPS 109 of Moje Village HANSPURA, Taluka Ahmedabad - City - East, in the District of Ahmed and Registration Sub District of Ahmedabad - 6 (Naroda)."

5. Name of Borrower/Co-Borrower/Guarantor : 1] Hiten Odhavjibhai Koria 2] Dhirajben Odhavji Koriya

78 Narmad Nagar Vibhag 2 B/H Navnirman School Ranip Ahmedabad Chandlodia I AN · PHAHAHMOOOO24427 NPA Date: 1st April.2021

Date of Demand Notice: 16th July,2021 Outstanding Amount As per 13(2) Notice : Rs.13,91,088/-**Property Address of Secured Assets**

"All that piece and parcel of immovable property bearing property situated at Flat No.B-404 admeasuring 125 Sq. Yrds, 1] Rambirsing Patisih Rajput 2] Raniben Rambirsing Rajput Satellite Park, Survey No.195/3, Town Planning Scheme No.3, Final Plot No.36 Mouje Bavl, Taluka Bavla, Distric

hmedabad Registration Sub District Bavla. Name of Borrower/Co-Borrower/Guarantor

202, Siddhi Vinayak Residency Opp Vinayak Vatika, B/H St. Merry School Nr Akash Ganga Bunglows Narod hmedabad Gujarat Naroda I E

l] Lataben Rajendrakumar Shah 2] Adityakumar Rajeshkumar Shah 3] Rajendrabhai Hiralal Shah

LAN: RHAHAHM000074601 Date of Demand Notice: 29th July.2021 NPA Date: 11th April.2021 outstanding Amount As per 13(2) Notice : Rs.1297046/ **Property Address of Secured Assets**

'All that piece and parcel of immovable property being Flat No.401, 3rd Floor, in Block - F, having area admeasur

71.07 Sq.Mtrs. at & in PANGARI (NARODA) CO-OPERATIVE HOUSING SOCIETY LIMITED in the scheme known as "PUNJARI RESIDENCY" situated at land bearing Survey No.752 being Final Plot No.54 of Town Planning Scheme No.2 (TP-39) of Mouje NARODA Taluka Asarwa in the Registration District of Ahmedabad & Sub District of Ahmedaba 6 (Naroda) within the State of Gujarat...

7. Name of Borrower/Co-Borrower/Guarantor :] Manoj Suresh Madhwani 2]Bhumika Manojkumar Madhwani 02 Shiv Sagar Apt Nr Rama Biscuit Factory Saijpur Bogha Ahmedabad Gujarat Saijpur Bogha

LAN: RHLPAHM000023317 NPA Date : 06th April,2021 Date of Demand Notice : 29th July,2021 Outstanding Amount As per 13(2) Notice : Rs.787964/-

Property Address of Secured Assets 'All that piece and parcel of immovable property bearing property Flat No.102 on 1st floor, adm.90 sq.yrds a a memher of SHIV SAGAR CO-OPERATIVE HOUSING SOCIETY LTD, known as "SHIV SAGAR APPARTMENT" situated a

Survey No.42+43, Plot No.10 & 26 Paiki [City Survey No.1056 & 1057 Paiki] of Mouje Village SAIJPUR-BOGHA Taluka City in the Registration District of Ahmedabad and Sub District Ahmedabad - 6 (NARODA). Name of Borrower/Co-Borrower/Guarantor : 1.Pradeep Chellappan Acharya 2.Kavitaben Pradeepkumar Acharya
B 04 Padmavati Nagar Flat Near Hariom Nagar Dcabin Sabarmati Ahmedabad Gujarat Ahmedabad Railway Colony

AN: RHAHAHM000051074 NPA Date: 11th April,2021 Outstanding Amount As per 13(2) Notice : Rs.1398127/-

Property Address of Secured Assets All the piece and parcel immovable property bearing Flat No. B-5 on 1st Floor, admeasuring 55.44 Sq.mtrs. As a me ber of PADMAVATI CO-OPERATIVE HOUSING SOCIETY LTD. Situated at land bearing Survey No. 215/1 [Final Plot No. 57 & 67 of TPS 19] situated at mouje KALI Taluka Sabarmati in the District of Ahmedabad & Registration Sub istrict of Ahmedabad-2 [WADAJ]."

. Name of Borrower/Co-Borrower/Guarantor .Ramchand Topandas Mirchandani 2.Mohini Ramchand Mirchandani 3.Mukesh Ramchand Mirchandani

7, Satguru Park Society, Bunglow Area Kubernagar Ahmedabad Gujarat Sardarnagar LAN: RHHLAHM000013023 NPA Date: 06th April 2021 Date of Demand Notice: 29th July.2021 Outstanding Amount As per 13(2) Notice: Rs.955452/-Property Address of Secured Assets "All that piece and parcel of immovable property bearing property situated at Flat No.C-202 on 2nd Floor, adm.170 Sq.Yrds as a member of HANUMANNAGAR CO-OPERATIVE HOUSING SOCIETY LTD. known as "KARNAWATI

CLASSIC RESIDENCY" situated at land bearing Survey No.361 being Final Plot No.72 paiki of TPS 67/1 of mouje HANSOL Taluka City in the Registration District of Ahmedabad and Sub District Ahmedabad - 6 (Naroda). 10. Name of Borrower/Co-Borrower/Guarantor:

I.Shripal Muraradan 2.Laxmidevi Shripal Rohit Trailor Transport Kishanvila Complex No 5 Flr Bhamariya Kuvo Narol Aslali Road Ahmedabad Gujarat Narol/ 2/55 Phase-1 Om Shantinagar-2 Nr Bhammariya Kuva Narol To Lambha Narol Ahmedabad Gujarat-382405

LAN: RHAHAHM000058315 NPA Date: 11th April,2021 Date of Demand Notice: 7th August, 202 Outstanding Amount As per 13(2) Notice : Rs.980261/-**Property Address of Secured Assets** All that piece and parcel of immovable property bearing property situated at Flat No.55, "B" Type, Block No.E-2 on 5th Floor secured creditor.

19. Name of Borrower/Co-Borrower/Guarantor: 1.Sanjay Omkarbhai Luhar 2.Jyoti Pratap Panchal

Built up area) in scheme known as "UMANG HOME" situated at Non-Agricultural land bearing Block No. 642+643/A admeasuring 10938 Sq.Mtrs., Block No. 642+643/C admeasuring 4570 Sq.Mtrs & Block No. 642+643/E admeasuring

20. Name of Borrower/Co-Borrower/Guarantor: 1]Kantilal Harjivanbhai Patel 2] Premilaben Kantibhai Patel

32 Shrushti Residency N/R Sudarshan Chowk Mehsana Gujarat Dangarya LAN: RHAHVAS000071711 & RHATVAS000073069 NPA Date: 11th June.2021

Date of Demand Notice: 20th August, 2021

Property Address of Secured Assets

Alongwith undivided share in the land admeasuring 19.53 Sq.Mtrs. (including common plot, road etc.) together with construction area admeasuring 91.97 Sq.Mtrs. (Built-up) standing thereon in the scheme known as "SHRUSHTI RESIDEN CY" a scheme constructed on Freehold Non Agricultural land bearing Survey Nos. 16/3, 17/1 & 17/2 of Block No. 16

of Securitisation and Re-construction of Financial Assets and Enforcement of Security Interest Act. 2002 and

the applicable rules thereunder Please note that under Section 13 (13) of the said Act, no Borrower shall, transfer by way of sale, lease or otherwise any of his secured assets referred to in the notice, without prior written consent of the

Sd/- Authorised Officer Reliance Home Finance Ltd.

Tulsi Market, Nr. Rushabh Petrol Pump, Ring Road, SURAT-395002. Tel: 0261-2302360, 2368571, E-mail: bm1118@unionbankofindia.com

DEMAND NOTICE (Under Sub-Section (2) of Section 13 of the Sarfaesi act, 2002)

Ref. No.111830100008179

Date : 18/06/202

r Sir/Madam.

epayment of dues/ installments/ interests. As on 01.04.2021, a sum of Rs 18,93,370/- (Rupees Eighteen lakhs ninety three thousand three hundred seventy only) is outstanding in your account as shown below.

Housing Loan | 18,00,000.00/- | 01/04/2021 | 8.35%

of the bank by exercising any or all of the rights given under the said Act. DETAILS OF THE SECURED ASSETS:

Please note that if you fail to remit the dues within 60 days and if Bank exercises all it rights under this Act and if the dues not fully satisfied with the sale of proceeds of the secured assets, we shall be constrained to take appropriate legal action against you in

Yours Faithfully

11. Name of Borrower/Co-Borrower/Guarantor :

. Vijay Ghanshyamdas Vardhani 2.Hiral Vijaykumar Vardhani

D 16 Ashray Flats, Nr Indira Bridge, Hansol, Sardarnagar Ahmedabad Gujarat Sindhi Ambawadi NPA Date: 06th April 2021 LAN: RHAHAHM000017171 Date of Demand Notice: 7th August, 2021 Outstanding Amount As per 13(2) Notice: Rs.1588731/-**Property Address of Secured Assets**

"All that piece and parcel of immovable property bearing property situated at Flat No.C/503 on 5th Floor in Scheme . known as "OZONE CITY" situated at Survey No.282 (consisting of Survey No.282/1+2, 288, 289 and 299/1+2) F.P.No of T.P.No.97 of Mouje Naroda, Taluka City, District Ahmedabad. 12. Name of Borrower/Co-Borrower/Guarantor:

1. Vishal Rajgopal Rangwani 2.Sunita Rajgopal Rangvani 3.Rajgopal Vishandas Rangvani B 74 Shiv Tower Opp Mahalaxmi Dairy Juna Wadaj Ahmedabad Gujarat Naranpura

LAN: RHAHAHM000032102 NPA Date: 06th April.2021 Date of Demand Notice: 7th August, 2021 Outstanding Amount As per 13(2) Notice: Rs.1393560/-Property Address of Secured Assets "All that piece and parcel of immovable property bearing property situated at Flat No.H-304 adm.112 Sq.Yrds Maruti

Shrishti, Old Survey No.71, New City Survey No.2245 (Old City Survey No.8718 & 8719), Sardarnagar Ward - I, Mouie Naroda, Tulaka City, District, Ahmedabad Registration Sub District Ahmedabad - 6 (Naroda).

13. Name of Borrower/Co-Borrower/Guarantor: 1]Bhikhubhai Trikambhai Parmar 2] Punam Bhikhubhai Parmar 3] Divyesh Manajibhai Vadhe

E 104 Shantiniketan 3 899 Raf Camp Vastral Ahmedabad Gujarat/ D/502, Shantiniketan- 3 Raf Camp Vastra Ahmedahad Gujarat LAN: RHAHAHM000046904 NPA Date: 11th May,2021 Date of Demand Notice: 7th August, 2021

Outstanding Amount As per 13(2) Notice: Rs.1948910/-**Property Address of Secured Assets** "All that piece and parcel of immovable property bearing property situated at Flat No.E/502 on 5th Floor of

M/s.Murlidhar Venture a Partnership Firm in the Scheme known as "SHYAMVILLA-3" situated at Survey No.360, Final Plot No.42 of Town Planning Scheme No.101 of Mouje Nikol, Taluka Asarwa, District Ahmedabad." 14. Name of Borrower/Co-Borrower/Guarantor:

Himmatpura Veda Ta Kalol Dist Gandhi Nagar Chaudhari Vas, Nardipur Mehsana Gujarat LAN: RHAHMEH000072678 NPA Date: 11th May,2021 Date of Demand Notice: 7th August, 2021 Outstanding Amount As per 13(2) Notice: Rs.6,93,897/-**Property Address of Secured Assets**

"All that piece and parcel of immovable property bearing property situated at structure standing thereon being the Non

Agriculture, Residential Plot out of R.S. No.1130/1 P., Salable Flat No.B/203, N.A. Plan Flat No.D/215, adm.56.18 Sq.Mtrs. and undivided share 20.10 Sq.Mtrs. total adm.76.28 Sq.Mtrs. constructed in the Scheme known as "Radhe Greens" situated at in the Freehold Non-Agricultural land bearing of Mouje Mansa Taluka Mansa District Gandhinaga

and Registration Sub-District of Mansa within the State of Guiarat."

11 Hamirsinh Amuii Rathod 21 Harshrai Hamirsinh Rathod

15. Name of Borrower/Co-Borrower/Guarantor : 1] Mangaram Gopaji Chandora 2] Pavandevi Mangaram Chandora 3] Mahesh Magaram Chandora

26 Alok Tenament Part 2 Maheshwari Nagar Road Takshshila Road Vastral Ahmedabad Date of Demand Notice : 7th August,2021 LAN: RHAHAHM000056193 NPA Date: 11th May,2021 Outstanding Amount As per 13(2) Notice : Rs.1795053/-

Property Address of Secured Assets 'All that piece and parcel of immovable property bearing property sitauted at Sub-Registration District Ahmedabad,

Sq.Mtrs. which is included Town Planning No.1 and F.P.No.220 having 16670.00 Sq.Mtrs. land which included City Survey Number Odhav and City Survey No.925/3, SUb-Plot No.220/2/1/1 of 2898 Sq.Mtrs. inclused land in the Scheme known as "Solitaire Sky", Flat No.B-103, First Floor, Near Gurudwara, B/h.Pushkar Hill, Odhav."

LAN: RHAHAHM000048205 NPA Date: 06th May,2021

Date of Demand Notice: 7th August, 2021 Outstanding Amount As per 13(2) Notice: Rs.1013589/-Property Address of Secured Assets 'All that piece and parcel of immovable property bearing property situated at Row House No.32 in the Scheme known

and Registration Sub District of Ahmedabad - 12 (Nikol)." 17. Name of Borrower/Co-Borrower/Guarantor:

Property Address of Secured Assets "All that piece and parcel of immovable property bearing property sitauted at Flat No.704-Shyam Avenue. Near Radhe Tenament, Manthan 222 to Ayappa Madrasi Mandir Road, Vatva having Survey No.1072, Final Plot No.34 of Town

Outstanding Amount As per 13(2) Notice: Rs.2235950/-**Property Address of Secured Assets** 'All that right, title and interest of Flat No.B-503 admeasuring 175 Sq.Yrds. (Super Built Up Area) Fifth Floor, Shyamvilla

Taluka, City, District Ahmedabad in the Registration District of Ahmedabad & Sub District of Ahmedabad - 6 (Naroda)

24 Prayag Park Society Opp Panchayat Office Vastral Gam Ahmedabad Gujarat Vastral

Property Address of Secured Assets 'All that Piece & Parcel of Immovable Property being Duplex Row House No. 15 admeasuring 43.12 Sq. Yards. (Supe

"All that Piece & Parcel of Immovable Property being Row House No. 33, having plot area admeasuring 42.68 Sq.Mtrs.

including taking possession of the secured assets of the borrowers and the mortgagors under Section 13(4)

District Ahmedabad - 7 (Odhav) Taluka Vatva of Mouje Village Odhav, having Survey Nos.26,27,28 paikee 16693.00

16. Name of Borrower/Co-Borrower/Guarantor] Mukeshkumar Rooplalji Luhar 2] Manjula Mukeshbhai Luhar 572 Kamlesh Park 3 Nr Taxshila School B/S Kilol Nagar Bhikshuk Gruh Odhav Ahmedabad Gujarat Odhav I E

as "UMANG HOME" situated at Non-Agricultural land bearing Block No.642+643/A admeasuring 10938 Sq.Mtrs., Block No.642+643/C admeasuring 4570 Sq.Mtrs. & Block No.642+643/E admeasuring 1109 Sq.Mtrs. total admeasuring 16617 Sq.Mtrs. situated at Mouje Village VEHLAL, Taluka City-East [Old Taluka-Dascroi] in the District of Ahmedaba

49 Nilgiri Chhapra Chandola Talav Danilimda Ahmedabad Gujarat Bhairavnath Road LAN: RHAHAHM000061699 NPA Date: 11th May,2021 Date of Demand Notice: 7th August, 2021 Outstanding Amount As per 13(2) Notice: Rs.839837/-

Planning Scheme No.86 of Mouje Vatva, Taluka Vatva of District Ahmedabad." 18. Name of Borrower/Co-Borrower/Guarantor : I]Shriram Bhaskarbabu Pandey 2] Ranjana Shriram Pandey 323 Sheth Anandji Kalyanji Ni Chali Opp New Com Mill Naroda Road Ahmedabad Gujarat Naroda I E LAN: RHAHAHM000033014 NPA Date: 16th May,2021 Date of Demand Notice: 7th Date of Demand Notice : 7th August 2021

Greens, Survey No.640 and 641, Final Plot No.50 and 51, Draft Town Planning Scheme No.121 of Mouje Naroda,

LAN: RHAHAHM000047023 NPA Date: 6th June,2021 Date of Demand Notice: 19th August,2021 Outstanding Amount As per 13(2) Notice: Rs.946710/-

1109 Sq.Mtrs. Total admeasuring 16617 Sq.Mtrs. Situated at Mouje Village Vehlal, Taluka City-East [Old Taluka-Dascro Date of Demand Notice: 29th July,202 n the District of Ahmedabad and Registration Sub District of Ahmedabad-12 (Nikol).."

Outstanding Amount As per 13(2) Notice: Rs.14,14,828/-

being Final Plot No. 12 of Town Planning Scheme No. 6 adms.2652 Sq.Mtrs. of Mouje Borisana Taluka Kalol in the District of Gandhinagar and Registration Sub District of Gandhingar within the State of Gujarat." In the circumstances as aforesaid, the notice is hereby given to the above borrowers, co-borrowers and/ or their guarantors (where ever applicable) to pay the outstanding dues as mentioned above along with future interest and applicable charges within 60 days from the date of the publication of this notice failing which further steps will be taken after the expiry of 60 days of the date of this notice against the secured assets

of in the Scheme known as "Omshantinagar - 2 Phase -1 constructed by M/s.Santosh Associates sitauted at Survey No.479/K, Dated: 08.09.2021

Final Plot No.15 (1+2) / 2 Paiki Sub Plot No.2 paiki, of T.P.S. No.58 of Mouje, Vatva Taluka Vatva & District: Ahmedabad." Place: Ahmedabad

સમાધાનની ફોર્મ્યુલા અંગે

જાડેજાએ જણાવ્યું હતું કે બરોડા

ડેરીની આગામી ૧૫ સપ્ટેમ્બરના

રોજ મળનારી વાર્ષિક જનરલ

સભામાં સાવલીના ધારાસભ્ય

બરોડા ડેરીના ચેરમેન દિનેશ પ

માંગણી નોટિસ

સિક્યોરિટાઈઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઈનાન્સીયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઈન્ટેરેસ્ટ એક્ટ ૨૦૦૨ ની કલમ ૧૩ (૨) અંતર્ગત નોટીસ

સિક્ચોરિટાઈઝેશન એન્ડ રિકન્સ્ટ્રુક્શન ઓફ ફાઈનાન્સીયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્ચોરિટી ઈન્ટેરેસ્ટ એક્ટ ૨૦૦૨ (સદર કાયદો) ની કલમ ૧૩ (૨) અને સીક્યોરીટી ઈન્ટેસ્ટ (એન્ફોર્સમેન્ટ)ના નીયમો ૨૦૦૨ (સદર નીયમો) ના નિયમ ૩ (૧) સાથે વંચાલે લઈ સદર કાયદાની કલમ ૧૩ (૧૨) હેઠળ આપવામાં આવેલ સત્તાનો ઉપયોગ કરીને સદર નિયમ ૩ સાથે વંચાણે લઈ અધિકૃત અધિકારીએ સદર કાયદાની કલમ ૧૩ (૨) હેઠળ આ માંગણી નોટિસ દેવાદાર (રો)/સહ-દેવાદારો, ગેરંટર/ રોને તેમને આપવામાં આવેલી લેણાંની રકમ (સંબંધિત ડિમાન્ડ નોટિસમાં ઉલ્લેખિત) પરત કરવા માટે બોલાવવા જારી કરેલ છે. ઉપરોક્ત નોટીસ દ્વારા દરેક પક્ષકારોને કરી એકવાર આ નોટીસ પ્રકાશીત થયેથી ૬૦ દિવસની અંદર નીચે દર્શાવેલ રકમ આ માંગણી નોટીસની તારીખથી ચુકવવામાં આવે તે તારીખ સુધીના વ્યાજ સાથે ચુકવવા તક આપવામાં આવે છે. આ માંગણી નોટીસની તારીખ સુધી દેવાદાર(રો)ની બાકી લેણીની રકમ અને લોનની રકમ અને ચુકવણી પરત્વેની જમાનતનું વિવરણ નિચે મુંજબ છેઃ

ક્રમ	લોન એગ્રીમેન્ટ નં./દેવાદારો/સહ-દેવાદરો/ સહ-અરજદારના નામ /ગેરેન્ટરોના નામ	માંગણી નોટીસની તારીખ અને રકમ	જમાનત સંપત્તિનું વર્ણન (સ્થાવર મિલકત/તો)			
૧	એલએક્સબીએઆર ૦૦૪૧ દ ૧૭૦૦૨૪૮૯૫/હિતેશ રાજુભાઈ યાદવ/રેખાબેન હિતેશ યાદવ/રાજુભાઈ કનુભાઈ રાઠોડ	૨૫-મે-૨૦૨૧/રૂ. ૧૭,૨૯,૦૪૯/- (ફક્ત રૂપિયા સત્તર લાખ ઓગણત્રીસ હજાર ઓગણપચાસ)	ફ્લેટ નં - બી - ૨૦૧, બીજો માળ, આનંદવન રેસીડેન્સી, રેવન્યુ સર્વે નંબર - ૨૬૬/૧ (જુનો), બ્લોક નંબર - ૨૪૧, ટી.પી. સ્ક્રીમ નંબર - ૦૨, એફ.પી. નંબર – ૫૭, દાંડિયા બજાર રોડ ભાયલી, પ્રિયા સિનેમા પાસે, વડોદરા, ગુજરાત – ૩૯૦૦૦૧			
Serial control course of a serial control course of the serial control contro						

જો ઉક્ત દેવાદારો ઉપરોક્ત મુજબ એએચએફસીએલને ચુકવણી કરવામાં નિષ્ફળ જશે, તો એએચએફસીએલ એક્ટની કલમ ૧૩ (૪) અને લાગ નિયમો હેઠળ ખર્ચ અને પરિણામો માટે સંપૂર્ણપણે દેવાદારોના જોખમે ઉપરોક્ત જમાનત સંપત્તિ પરત્વે કાર્યવાહી કરશે. સદર દેવાદારોએ એએચએફસીએલની પૂર્વ લેખિત સંમતિ વિના વેચાણ, લીઝ અથવા અન્ય[ે]શ ઉપરોક્ત અસ્કયામતોને સ્થાનાંતરિત કરવું તે કાયદા હેઠળ પ્રતિબંધિત છે. કોઈપણ વ્યક્તિ કે જે ઉપરોક્ત અધિનિયમ અથવા તે અંતર્ગત બનાવેલા નિયમોની જોગવાઈનું ઉલ્લંઘન કરશે અથવા તો તે મુજબ વર્તશ[ૅ]નહી તો કાયદાની જોગવાઈ મુજબ કેદ અને/અથવા દંડ માટે જવાબદાર રહેશે. સ્થળ : ગુજરાત

તારીખ: ૦૮-૦૯-૨૦૨૧ ભાષાંતરમાં ત્રુટી અથવા વિસંગતતા હશે તો અંગ્રેજી સંસ્કરણ માન્ય રહેશે.

અધિકૃત અધિકારી (એસ્પાયર હોમ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ)

FEDERAL BANK

લોન કલેકશન એન્ડ રીકવરી ડીપાર્ટમેન્ટ / મુંબઈ ડીવીઝન ધ કેડરલ બેંક લી.

LCRD/ मुंजर्ध डीवीञन

એડ્રેસઃ 93૪, 93મો માળ, જોલી મેક્સ ચેમ્બર્સ નં.૨, નરિમાન પોઈન્ટ, મુંબઈ ૪૦૦૦૨૧ //એડી સાથે સ્પીડ પોસ્ટ //

- ૧. મેસર્સ નીલકંઠ ઇન્ડસ્ટ્રીસ, ભાગીદારી પેઢી ની ઓફિસ જે ૬૦૮/७/એ, જીઆઇડીસી, મકરપુરા, જગપચ એન્જીન્ચરીંગ પાસે, વડોદરા,
- ૨. શ્રી ધર્મેશ બી નકરાની, ઉંમર ૩૫ વર્ષ, જે ભુપતભાઇ નકરાનીના પુત્ર, રહેણાંક ૨, મનમોહન સોસચટી, ગ્લોબલ બરોડા હોસ્પિટલ પાસે, માંજલપુર, વડોદરા, ગુજરાત- ૩૯૦૦૧૧.
- 3. શ્રી વિપુલ નરેનભાઈ કેઠરોટીયા, ઉંમર ૩૮ વર્ષ, જે નરેનભાઈ કેઠરોટીયાના પુત્ર, રહેણાંક ૩૯૫,વિજય નગર, તરસાલી

સિકચોરિટાઈગ્રેશન એન્ડ રીકન્સ્ટ્રકશન ઓફ ફાઈનાન્શિયલ એસેટ્સ એન્ડ એનફોર્સમેન્ટ ઓફ સિકચોરીટી ઈન્ટરેસ્ટ, કાયદો,

૨૦૦૨ (હવે પછી કાયદો તરીકે ઉલ્લેખ પામશે) ના સેક્શન ૧૩(૨) હેઠળ મોક્લેલ નોટિસ તમારામાના પ્રથમને મુખ્ય દેવાદાર અને બીજાને સહ-દેવાદાર તરીકે રૂા. ૧૦,૦૦,૦૦૦/- (રૂપિયા દસ લાખ પુરા)ની કેશ ક્રેડીટ લોન સુવિધા ૨૪/૦૩/૨૦૧૭ ના રોજ ધ ફેડરલ બેંક લિમિટેડ તે કંપનીધારા હેઠળ રજિસ્ટર થયેલી અને અલ્વાયે ખાતે રજિસ્ટર્ડ ઓફિસ ધરાવતી કંપની(હવે પછી બેંક તરીકે ઉલ્લેખાશે)ની વડોદરા શાખા પાસેથી ધિરાણ ખાતા નં.૧૩૩૫૬૯૦૦૦૦૦૭૧૩ માં બેંકની તરફેણમાં જરૂરી સિક્યોરિટી એગ્રીમેન્ટ્સ/ધિરાણ દસ્તાવેજોની કાર્યવાહી કરીને મેળવેલ.

બેંક પાસેથી મેળવેલ ઉપરોકત સુવિધાઓ માટે સુકયોરિટી તરીકે તમો નં.૧ બેંકની તરફેણમાં નીચે જંગમ અને સ્થાવર મિલ્કતોનું ગીરોખત કરીને ,સિકયોકિટી ઈન્ટરેસ્ટ ઊભું કરેલ.

ગીરો રાખેલ જંગમ મિલ્કતોનું વર્ણન

CNC હલેથ મશીન મોડેલ MONO 300 નું હાઈપોથીકેશન

ઉપરોક્ત ગિરવે સિક્યોરિટી મિલ્કતો હવે 'સિકયોર્ડ અસ્કયામતો' તરીકે ઉલ્લેખાશે તમે ઉપરના સિકયોર્ડ દેણાની પરત ચુકવણીમાં કસુરક કરીને માન્ય શરતોનો ભંગ કર્યો છે અને ખાતું ૩૦-૦૩-૨૦૨૧ના રોજ આરબીઆઈની ગાઈડલાઈન મુદબ નોન પરફોર્મીંગ એસેટ બન્યું

નીચે સહી કરનાર ધ ફેડરલ બેંક લિ.ના અધિકૃત અધિકારી તરીકે તમને જાણ કરે છે કે રૂા. ૨,૮૬,૮૭૧.૦૩(રૂપીયા બે લાખ છયાસી હજાર આઠસો ઈકોતેર અને ત્રણ પૈસા પુરા) ની રકમ ૨૪-૦૫-૨૦૨૧ થી વાર્ષિક ૧૨.૪૫% દરે માસિક ગાળા એ થતા વ્યાજ સાથે વત્તા કોસ્ટ્સ સહીંતની રકમ , અને તેમની લોન એકાઉન્ટ સાથે તમારી પાસેથી બેંકની વડોદરા શાખા સાથેના તમારા ધિરાણ ખાતાઓમાં લેવાની નીકળે છે.

આથી બેંક સિક્યોર્ડ ક્રેડિટર તરીકે કાયદાની કલમ ૨ (zd) હેઠળ જણાવ્યા અનુસાર જણાવેલ કાયદાની કલમ ૧૩(૨) હેઠળ જણાવ્યા અનુસાર આથી તમોને આ નોટીસની તારીખથી ૬૦ દિવસની અંદર જણાવેલ રકમની સાથેસાથે ચુકવણીની તારીખ સુધી તેના પર ચડત વ્યાજ અને ખર્ચ/અન્ય ચાર્જ સહિત ચુકવી જવા જણાવે છે, જેમાં નિષ્ફળ જતા બેંકને સિક્યોર્ડ ક્રેડિટર તરીકે કોઇ અન્ય નોટીસ આપ્યા વગર, તેના કોઇપણ અન્ય હકો અને ઉપાર્યોગ પ્રત્યે પુર્વગ્રહ વગર તમારી સામે એક્ટની કલમ ૧૩(૪) હેઠળ જણાવેલ પગલાંઓ લેવાની ફરજ પડશે. ૧.ઉપર વર્શન કરેલ સિકયોર્ડ અસ્કયામતોના કબજો લેવા અને લેણી રકમ વસૂલ કરવા તે કથિત અસ્કયામતોને લીઝ, એસાઈન્મેન્ટ અથવા

વેચાણ દ્વારા તબદિલ કરવી. ૨.સિકયોર્ડ અસ્કયામતોનો વહીવટ હાથમાં લેવો અને લેણી ૨કમ વસુલ કરવા તે કથિત અસ્કયામતોને લીઝ, એસાઈન્મેન્ટ અથવા વેચાણ

દ્વારા તબદિલ કરવી. ૩.બેંક કબજે લીધેલ અસ્કયામતોનો વહીવટ કરવા માટે કોઈ વ્યક્તિની નિમણુક કરવી.

૪.તમારી પાસેથી કોઈ પણ સિકયોર્ડ અસ્કયામત સંપાદિત કરી હોય અને જેની પાસેથી તમારે કોઈ પૈસા લેણા થતા હોય તે બેકને ચુકવવા માટે તેવી કોઈ પણ વ્યકિતને કોઈ પણ સમયે લેખિત નોટીસ જરૂર પડયે આપવી.

તમને કાયદાના સેકશન ૧૩(૧૩) તરફ ધ્યાન દોરવામાં આવે છે કે તમે આ નોટીસ મળ્યા પછી, વેચાણ, લીઝ કે અન્ય કોઈ રીતે નોટીસમાં ઉલ્લેખ કરેલ કોઈ પણ સિકયોર્ડ અસ્કયામતોને બેંકના હિત માટે ગમે તે પૂર્વગ્રહ હોય પણ બેંકની લેખિત પૂર્વમંજૂરી સિવાય તબદિલ કરી શકશો નહીં.

તમને કાયદાના સેકશન ૧૩(૬) તરફ ધ્યાન દોરવામાં આવે છે જે દ્વારા બેંકની સિકયોર્ડ અસ્કયામતની તબદિલી જે આવી સિકયોર્ડ અસ્કયામચાના માલિક દ્વારા જે રીતે જે કે વ્યકિત(ટ્રાન્સફરી)ને કરવામાં આવી હોય તે વ્યકિતને તબદિલી માટે માન્ય ટાઈટલના તમામ અધિકારો આપવાનો, અથવા એનાં સંદર્ભમાં આપવા માટે તે રીતના અધિકાર આપે છે. મહેરબાની કરીને જાણી લેજો કે તમારી જવાબદારી આ નોટીસની તારીખ થી દિન ૬૦ માં પુરેપુરી અદા કરવામાં કરુસ કરવાની સ્થિતીમાં અને બેંક કાયદાની જોગવાઈઓ હેઠળ પગલાં લેવા શરૂ કરે તે સમયમાં તમે બેંકને તમામ કોસ્ટ,ચાર્જસ અને આ સંદર્ભમાં થનાર તમામ ખર્ચ આપવમાં બંધાયેસા છો. તમને કાયદાના સેકશન ૧૩(૮) ની જોગવાઈ તરફ પણ ધ્યાન દોરવામાં આવે છે જેમાં સિકયોર્ડ અસ્કયામતો (સિકયોરિટી મિલ્કતો) છોડાવવાની સમય મર્યાદા

જણાવેલ છે. જો સિકયોર્ડ અસ્કયામતોના વેચાણથી પણ લેલું પુરે પુરું વસુલ નહીં થાય, તો બેંક બાકીની રકમની વસુલાત માટે વ્યક્તિગત રીતે તમારી સામે કાર્યવાહી કરશે. આ નોટિસ બેંકને એના લેણાની વસુલી કરવા માટેમળેલ અન્ય અધિકારો એને ઉકેલના પૂર્વગ્રહ વિના મોકલેલ વતી, ધી ફેડરલ બેંક લી. Lecin C આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ અને શાખા હેડ

LCRD/ મુંબઈ ડીવીઝન (સરફ્રેસી એકટ, ૨૦૦૨ હેઠળ અધિકૃત અધિકારી)

ADVANCE SYNTEX LIMITED (CIN: L17119GJ199OPLC014406

E-mail: midas1002003@hotmail.com, Website: www.midasglitter.com ૩૧મી AGM, ઇ-વોટિંગ અને બુક કલોઝર માટે સૂચના

Regd. Office: 233/2 & 238/2, POR G.I.D.C. RAMANGAMDI. /ADODARA, GJ - 391243 **Tel. No. :** +91-8980028937,

કંપનીઓ (મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન) નિયમો, ૨૦૧૪ ના નિયમ ૨૦ મુજબ કંપનીના સભ્યોની ૩૧ મી

વાર્ષિક સામાન્ય સભા સંપૂર્ણ વિડીયો કોન્ફરન્સિંગ ("VC")/અન્ય ઓડિયો-વિઝ્યું અલ માધ્યમો (''દ્વારા આપવામ

આવે છે. OAVM ") ગુરુવારે, ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ બપોરે ૧:૦૦ વાગ્યે (IST), એપ્રિલ અને મે

ર ભરાભમાં બહાર પાડવામાં આવેલા સામાન્ય પરિપત્ર નંબર ૧૪/૨૦૨૦, ૧૭/૨૦૨૦, ૨૦/૨૦૨૦ અને કોર્પોરેટ

બાબતોના મંત્રાલય (''એમસીએ''), સરકાર દ્વારા જારી કરાયેલા અન્ય તમામ લાગુ કાયદાઓ અને પરિપત્રોના

પાલન માટે ભારતની સિક્ચોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ મીટિંગની નોટિસમાં સમાવિષ્ટ

ઉપરોક્ત પરિપત્રોનું પાલન કરીને, ૩૧મી AGM અને વાર્ષિક અહેવાલ ૨૦૨૦-૨૧ ની નોટિસની ઇલેક્ટ્રોનિક

નકલો ૦૭/૦૯/૨૦૨૧ ના રોજ તમામ શેરધારકોને મોકલવામાં આવી છે. જેમના ઈ-મેલ સરનામાં કંપની

ડિપોઝિટરી સહભાગીઓ સાથે નોંધાયેલા છે. તેની એક નકલ કંપનીની વેબસાઇટ www.midasglitter.com

કંપની (મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન) સુધારા નિયમો, ૨૦૧૫, રેગ. ઈન્સ્ટિટ્યુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ

ઈન્ડિયા દ્વારા જારી કરાયેલા સેબી રેગ્યુલેશન્સ અને SS-2 ના ૪૪, કંપની પાસે ૨૩મી સપ્ટેમ્બર ૨૦૨૧ છે, રિમોર્ટ

ઈ-વોટિંગ દ્વારા મતદાનની પાત્રતા નક્કી કરવા માટે કટ-ઓફ તારીખ તરીકે, સહભાગી અથવા ઈ-વોટિંગ માટે

AGMમાં કંપની નોટિસમાં નિર્ધારિત તમામ ઠરાવો પર ઇલેક્ટ્રોનિક રીતે દૂરસ્થ ઈ-વોટિંગ દ્વારા અથવા ઈ-વોટિંગ

સિસ્ટમ મારફતે મત આપવા માટે કટ-ઓફ તારીખ એટલે કે ૨૩મી સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ સભાસદોને સુવિધ

પૂરી પાડીને ખુશ છે, જેના માટે કંપનીએ ઇ-વોટિંગ એજન્સી તરીકે નેશનલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડની સેવાએ

(i) ૩૧ મી AGMની નોટિસમાં દર્શાવ્યા મુજબ સામાન્ય અને ખાસ વ્યવસાય ઇલેક્ટ્રોનિક માધ્યમથી મતદાન દ્વારા

(ii) રિમોટ ઈ-વોટિંગ સોમવાર, ૨૭/૦૯/૨૦૨૧ ના રોજ સવારે ૦૯.૦૦ વાગ્યે શરૂ થશે. (IST) અને બુધવાર

(iii) ૩૧ મી AGMમાં ભાગ લેનારા સભ્યો કે જેમણે રિમોટ ઈ-વોટિંગ દ્વારા પોતાનો મત આપ્યો નથી તેઓ એજીએમ

(iv) કોઇપણ વ્યક્તિ, જે ૩૧ મી એજીએમની નોટિસ મોકલ્યા બાદ અને ૨૩ મી સપ્ટેમ્બર ૨૦૨૧ ની કટ ઓફ

તારીખ મુજબ શેર હોલ્ડિંગ કર્યા બાદ કંપનીનો સભ્ય બને છે, તે evoting@nsdl.co.in પર અથવા કંપનીન

ઇમેઇલ આઈડી cs@midasglitter.com પર વિનંતી મોકલીને લોગિન આઈડી અને પાસવર્ડ મેળવી શકે છે

જો કે. જો કોઈ વ્યક્તિ પહેલેથી જ રિમોટ ઈ-વોટિંગ માટે એનડીએસએલમાં નોંધાયેલ હોય તો હાલના યઝ

સભ્યો નોંધ કરી શકે છે કે a) રિમોટ ઇ-વોટિંગ મોડ્યુલ એનડીએસએલ દ્વારા ઉપરોક્ત તારીખ અને સમય

પછી મતદાન માટે નિષ્ક્રિય કરવામાં આવશે અને એકવાર સભ્ય દ્વારા ઠરાવ પર મતદાન કરવામાં આવે તે

પછી, સભ્યને તેને બદલવાની મંજૂરી આપવામાં આવશે નહીં ત્યારબાદ; b) જે સભ્યોએ ૩૧મી AGM પહેલ

રિમોટ ઈ-વોટિંગ દ્વારા પોતાનો મત આપ્યો છે તેઓ VC/OAVM સુવિધા મારફતે ૩૧મી AGM માં ભાગ

લઈ શકે છે પરંતુ ૩૧ મી AGM દરમિયાન ઈ-વોટિંગ સિસ્ટમ દ્વારા ફરીથી તેમના મત આપવા માટે હકદાર

રહેશે નહીં. c) જે વ્યક્તિનું નામ સભ્યોના રજિસ્ટરમાં નોંધાયેલું હોય અથવા ડિપોઝિટરીઓ દ્વારા કટ ઓફ

તારીખે જાળવવામાં આવતા લાભાર્થી માલિકોના રજિસ્ટરમાં ૩૧ મી એજીએમમાં ભાગ લઈને દૂરસ્થ ઈ-

મતદાનની સુવિધા મેળવવા માટે હકદાર રહેશે. ૩૧મી AGM દરમિયાન VC/OAVM સુવિધા અને ઈ-વોટિંગ

d) સભ્યોના મતદાન અધિકારો કટ ઓફ તારીખ એટલે કે ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ કંપનીની ચૂકવેલ

અને ઇ-વોટિંગ એજન્સીની વેબસાઇટ www.evoting.nsdl.com પર ઉપલબ્ધ છે.

સાથે સંકળાયેલી છે. તમામ સભ્યોને જાણ કરવામાં આવે છે કે:

૨૯/૦૯/૨૦૨૧ ના રોજ સાંજે ૦૫.૦૦ વાગ્યે સમાપ્ત થશે. (IST).

દરમિયાન ઈ-વોટિંગ દ્વારા પોતાનો મત આપવા માટે લાયક રહેશે

આઈડી અને પાસવર્ડનો ઉપયોગ મતદાન કરવા માટે થઈ શકે છે;

જેથી જાહેર જનતાને જણાવવાનું કે; સદર **.મરણ** ની નોંધ સામે કોઈને વાંધો કે રજુઆત હોય તો તેઓએ આ જાહેર નોટીસ પ્રસિધ્ધ થયેથી **દિન-૩૦ ની** અંદર અત્રેની કોટ સમક્ષ હાજર રહી તેઓના લેખીત વાંધા રજુ કરવા. મુદતની અંદર કોઇ લેખીત વાંધાઓ આવશે નહીં તો અરજદારની અરજમાં માંગ્યા મુજબ ની **મરણ** ની નોંધની અંગે આગળની કાર્યવાહી કરવામાં આવશે તેની નોંધ લેવી. આજે તા.૦૭ માઢે સપ્ટેમ્બર સને ૨૦૨૧ ના રોજ મારી સહી તથા કોર્ટનો સિક્કો કરીને આપ્યો. (હસમુખ એમ.ગોસાઇ) (પિયુષ એમ.ચાવડા) (આર.કી.ખલાસ) તૈયાર કરનાર મુકાબલ કરનાર સુધ્રિબ્ટેન્ડન્ટ, મ્યુલિ.કોર્ટ, વડોદરા

તારીખ ૨૯ મી મે ૨૦૨૧ ના દિવસે છે.

વડોદરા મહા સેવા સદન,(આરોગ્ય શાખા)કેવડાબાગ,વડોદરા

દ્ય ફેડરલ બેંક લી. અલ્ફાપુરી શાખા

અરજદાર તર્ફે વિ.વ.શ્રીઃ સ્વપ્નીલ શાહપટેલ ક્ષિપ્રઅ.નં.2741 / 2021 એ.વકોટરાના જચુકી. એજી.ક.ક.(સ્ચુનિ) સાહેબની કોર્ટમાં અરજદારઃ મોનીષ વિશ્વનાથ ભાદીયા સામાવાળા ૧ન મરણ નોંઘણે બધિકારીયી/સબ રઝસ્ટા

જાહેર નોટીસ આથી આ જાહેર નોટીસ આપી જાહેર જનતાને જણાવવાનું કે, આ કામના અરજદાર ના પત્ની નામે

રીટા મોનીષ ભાટીયા''નં મરણ તા. **27 - 05 - 2013** ના રોજ ૧૦૧, અમરવીલા, ગોત્રી રોડ, ઇસ્ક્રોન ઠાઇટસની પાછળ

ગોત્રી,વડોદરા મુકામે થયેલ છે. તે અંગેની નોંધણી સામાવાળાના**. મરણ** દક્તરે કરાવવા માટે હાલની અરજ અત્રેની કોર્ટમાં ગુજારેલી છે

વેચાણ નોટીસ નાથી તમામ સંબંધિતો અને જાહેર જનતાને જાણ અર્થે નોટીસ આપી જણાવવામાં આવે છે કે, ધ ફેડરલ બેંકની અલ્કાપુરી શાખામાં નીચે જજાવેલ ગોલ્ડ લોન ખાતેદારને ગીરો મુકવામાં આવેલ સોનાના આભુષષો છોડાવવા માટે સમયસર ચુકવણુ કરવામાં આવેલ નથી અને વારંવારની નોટીસ આપવા છતાં ચુકવણુ કરાયેલ ન હોય, જો તે ખાતાઓ તારીખ 14-09-2021ના રોજ અથવા તે પહેલા બંધ કરવામાં નહીં આવે તો ખાનગી વેચાણકારા વેચાણ કરવામાં આવશે.

કરવામાં નહાં આવે તા ખાનગા વચાશ દ્વારા વચાશ કરવામાં આવશે. ખાતેદારની વિગત						
ક્રમ	કરજદારનું નામ	ખાતા નંબર	લોનની મુદ્દલ સ્ક્રમ (રૂપિયામાં)	ગ્રોસ વજન (ગ્રામમાં)	નેટ વજન (ગ્રામમાં)	
1.	પંકજ ભાવસાર એન.	13356600000435	રૂા.1,41,119.00	287.85	280	
2.	પકજ ભાવસાર અન.	13356100042564	રૂા.৪,38,000.00	207.05		
3.	પ્રેમદાસન પુથલથ	13356400004256	રૂા.75,000.00	27	25.9	
4.	મનોજ રામચંદ્રન પીલ્લાઇ	13356100047183	રૂા.2,14,100.00	110.8	100	
5.	મનોજ રામચંદ્રન પીલ્લાઇ	13356100048330	રૂા.7,45,500.00	215.100	213	
6.	મનોજ રામચંદ્રન પીલ્લાઇ	13356100048355	રૂા.6,47,850.00	186	185.1	
તા. 08-09-2021 સ્થળ : વડોદરા કરજદારને 7 દિવસીય વેચાણ નોટીસ શાખા પ્રબંધક, અલ્કાપરી શાખા.						

ટેકનો ફોર્જ લિમિટેડ

CIN: L28910GJ1979PLC003508 નોંધાયેલ સરનામું: ૧૦૨૨, જો. આઈ.ડી.સી. એસ્ટેટ, અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત- ૩૯૦૦૦૨ પત્રવ્યવહારનું સરનામું: સી-૨૦૧, એમ્બેસી એપાર્ટમેન્ટ, કેતવ પેટ્રોલ પંપ પાસે, આંબાવાડી, અમદાવાદ - ૩૮૦૦૧ પ. ઈ-મેઈલ આઈ.ડી.: ipbhavishah@gmail.com, technoforgeltd@gmail.com

૪૨ મી વાર્ષિક સામાન્ય સભાની સૂચન

નાથી નોટિસ આપવામાં આવી છે કે કંપનીની ૪૨ મી વાર્ષિક સામાન્ય સભા વીડિયો કોન્ફરન્સિંગ (વી.સી.)/અન્ય ઓડિયો વિઝયઅ ીન્સ (ઓ.એ.વી.એમ.) મારફતે ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૧, ગુરુવારે સવારે ૧૧.૦૦કલાકે યોજાશે. એ.જી.એમ.માં કરવાના કામકાજન ાર્યસુચીની સૂચના નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના કંપનીના વાર્ષિક અહેવાલ સાથે સભ્યોને તેમના નોંધાયેલા ઇ-મેઇલ આઇ.ડી. પ મોકલવામાં આવેલ છે. જે સભ્યોનું ઇ-મેઇલ કંપનીમાં નોંધાયેલ નથી તેમને કંપનીને વિનંતી મેઇલ technoforgeltd@gmail.com પ મોકલીને નોંધણી કરાવવા વિનંતી કરવામાં આવે છે. કંપનીનો વાર્ષિક અહેવાલ કંપનીની સત્તાવાર વેબસાઈટ www.technoforgeindia om પર પણ ઉપલબ્ધ છે. વધુમાં એ.જી.એમ.ની નોટિસ લિંકસ્ટાર ઇન્ફોસિસ પ્રાઇવેટ લિમિટેડ (રિમોટ ઇ-વોટિંગ સુવિધા પૂરી પાડનાર એજન્સી)ની વેબસાઇટ https://evotingforibc.com પર પણ ઉપલબ્ધ છે. સભ્યોને એ.જી.એમ. અને વાર્ષિક અહેવાલની નોટિસની પ્રત્ય ાકલ મોકલવાની જરૂરિયાતને સંબંધિત એમ.સી.એ. પરિપત્રોથી દૂર કરવામાં આવેલ છે.

કંપની એ.જી.એમ.માં થનાર કામકાજ માટે લિંકસ્ટાર ઇન્ફોસિસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તેના સભ્યોને રીમોટ ઇ-વોટિંગ સુવિધા પૂરી પાડશે એ.જી.એમ.ની નોટિસની નોંધોમાં રિમોટ ઈ-વોટિંગની પ્રક્રિયા અને રીતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને લિંકસ્ટાર ઈન્ફોસિસ પ્રાઈવે લિમિટેડ (ઇ-વોટિંગ સુવિધા પૂરી પાડનાર એજન્સી) દ્વારા સભ્યોને અલગથી પણ જાણ કરવામાં આવેલ છે. કંપની એ.જી.એમ.માં થનાર કામકાજના માટે લિંકસ્ટાર ઇન્ફોસિસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તેના સભ્યોને રીમોટ ઇ-વોટિંગ સુવિધા પૂરી પાડશે. એ.જી.એમ.ની નોટિસની નોંધોમાં રિમોટ ઈ-વોટિંગની પ્રક્રિયા અને રીતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને લિંકસ્ટાર ઈન્ફોસિસ પ્રાઈવેટ લિમિટેડ (ઇ-વોટિંગ સવિધ પૂરી પાડનાર એજન્સી) દ્વારા સભ્યોને અલગથી પણ જાણ કરવામાં આવેલ છે.

તોઈપણ વ્યક્તિ, જેની પાસે કંપનીના શેર છે અને નોટિસ મોકલ્યા પછી અને કંપનીના સભ્ય બનેલ છે અને છેલ્લી (કટ-ઓફ) તારીખે એટલ કે ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ શેર ધરાવે છે તેઓ info@evotingforibc.com પર વિનંતી મોકલીને રિમોટ ઈ-વોર્ટિંગ માટે લોગિન

ભ્યોના મતદાન અધિકારો છેલ્લી (કટ-ઓફ) તારીખ એટલે કે ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ કંપનીની ચૂકવેલ ઇક્વિટી શેર મૂડીના તેમન શેરના પ્રમાણમાં રહેશે. રિમોટ ઇ-વોટિંગ અવધિ ૨૭ મી સપ્ટેમ્બર, ૨૦૨૧ (સવારે ૯,૦૦ વાગ્યે) શરૂ થશે અને ૨૯ મી સપ્ટેમ્બર, ૨૦૨^૦ (સાંજે પ.oo વાગ્યે) સમાપ્ત થશે. ત્યારબાદ લિંકસ્ટાર ઇન્ફોસીસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રિમોર્ટ ઇ-વોટિંગ મોડચુલને ડીસેબલ્ડ કરવામ આવશે. જો ઈ -વોટિંગ પ્રક્રિયા સંબંધિત કોઈ ફરિયાદો હોય તો તે શ્રી દિક્ષિત પ્રજાપતિ, લિંકસ્ટાર ઈન્ફોસીસ પ્રાઈવેટ લિમિટેડ, ૯ સી, વરદા કોમ્પ્લેક્ષ, લખુડી સર્કલ પાસે, નવરંગપુરા, અમદાવાદ -૩૮૦૦૦૯, ઈ-મેલઃ info@evotinaforibc.com. સંપર્કઃ ૭૮૭૪૧૩૮૨૩૭ ો કરવાની રહેશે. ઠરાવ પર એકવાર મતદાન કરીને સબમિટ થયા પછી, સભ્યોને તેને પછીથી બદલવાની મંજૂરી આપવામાં આવશે નહીં. મહેરબાની કરીને નોંધ લેશો કે જે વ્યક્તિનું નામ કંપની દ્વારા છેલ્લી (કટ-ઓફ) તારીખ એટલે કે ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ કંપની કારા જાળવવામાં આવેલા લાભદાયી માલિકોના રજિસ્ટરમાં નોંધાયેલં હશે. તે રીમોટ ઈ-વોટિંગની સવિધા મેળવવા માટે હકદાર બનશે. એ. જી.એમ.ના હેતુસર કંપની એક્ટ, ૨૦૧૩ ની કલમ ૯૧ મુજબ, સભ્યોનું રજિસ્ટર અને કંપનીની શેર ટ્રાન્સફર બુક ગુરુવાર ૨૩ મી તપ્ટેમ્બર, ૨૦૨૧ થી ગુરુવાર ૩૦મી સપ્ટેમ્બર, ૨૦૨૧ (બંને દિવસો સહિત) સુધી બંધ રહેશે. આ બેઠકની વિગતો કંપનીની વેબસાઇટ એટલે કે technoforgeindia.com પર પણ ઉપલબ્ધ છે.

ટેકનો ફોર્જ લિમિટેડ માટે (સી. આઈ.પી. આર.માં) વતી

સી.એ. ભાવિ શ્રેયાંસ શાહ રિઝોલ્યુશન પ્રોફેશનલ IP Reg. No.: IBBI/IPA-001/IP-IP-P00915/217-18/11521

ઇક્વિટી શેર મુડીમાં તેમના શેરના પ્રમાણમાં હશે. ૩૧મી AGM ની સૂચના અને વાર્ષિક અહેવાલ ૨૦૨૦-૨૧ કંપનીની વેબસાઇટ અને બીએસઇ લિમિટેડની વેબસાઇટ www.bseindia.com પર ઉપલબ્ધ છે. AGMની સૂચના એન ડીએસએલની વેબસાઇટ www

evoting.nsdl.com પર પણ ઉપલબ્ધ છે; /iii) ૩૧મી એજીએમના હેતુ માટે સભ્યોનું રજિસ્ટર અને કંપનીના શેર ટ્રાન્સફર બુક્સ ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૧ થી

૩૦ સપ્ટેમ્બર ૨૦૨૧ (બંને દિવસો સહિત) સુધી બંધ રહેશે.

iii) કોઈપણ પ્રશ્નોના કિસ્સામાં, તમે www.evoting.nsdl.com ના સહાય વિભાગમાં ઉપલબ્ધ શેરધારકો માટે શેરહોલ્ડરો અને ઈ-વોટિંગ વપરાશકર્તા માર્ગદર્શિકાઓ માટે વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) નો સંદર્ભ લઈ શકો છો અથવા evoting@nsdl.co પર વિનંતી મોકલી શકો છો. અથવા ટોલ ફ્રી નં. ૧૮૦૦૨૨૨૯૯૦ ઉપર સંપર્ક કરી શકો છો. જેઓ સાથે જોડાયેલી ફરિયાદોનું પણ નિરાકરણ કરશે. ઇલેક્ટ્રોનિક માધ્યમથી મતદાન સભ્યો કંપની સેક્રેટરીને ઈ-મેલ આઈડીઃ cs@midasglitter.com પર પણ લખી શકે છે.

એડવાન્સ સિન્ટેક્સ લિમિટેડ વર્તી

ભવન વોર મેનેજિંગ ડિરેક્ટર

માટે જગદીશચંદ્રે ડભોઈ કોર્ટમાં દાદ માંગી છે જેમાં ઘટનાસમયના પોલીસ મથકના ફુટેજ પુરાવા સ્વરૂપે કબજે કર્યા લેવા જોઈએ. સીસીટીવી કેમેરાના ફુટેજની નહોતા? તેમણે આરટીઆઈમાં માગણી કરી ડીએ સાપીનો

હતી. દરમિયાન ડભોઈ પોલીસે કરેલા રિપોર્ટમાં ગત ૪થી તારીખે આરટીઆઈમાં પણ હુમલાના જવાબમાં જણાવ્યું હતું કે ડભોઈ સમયના ફુટેજ પોલીસ સ્ટેશનમાં ૧૫ સરકારી કયા કારણોસર કેમેરા છે જેમાં ઓડિયો- નથી મેળવ્યા વિડીયોની સુવિધા છે. જોકે તેની પણ કેમ ૧૦-૮-૨૦૨૧ના રોજ અરજી કોઈ સ્પષ્ટતા મળી તે દિવસે ૧૦-૭—૨૦૨૧ કરી નથી?. સુધીનું સીસીટીવી ફુટેજ સ્ટોરેજ હતું તે પહેલાનું સિસ્ટમ દ્વારા કાર્યવાહીથી ઓટો ડિલીટ થયું છે જેથી માંગ્યા વૃધ્ધ મુજબની માહિતી રેકોર્ડ પર નથી. અને ડભોઈ પોલીસ જગદીશચંદ્ર પરિવારજનોના પર કથિત હુમલાના સમયના મનમાં હવે એવુ સીસીટીવી કેમેરાના ફુટેજ નથી ચિત્ર ઉપસી રહ્યું તેવા જવાબ આપીને હાથ અધ્ધર છે કે સીસીટીવી કર્યા છે. જોકે આરટઆઈના કેમેરાના જવાબ મુજબ પોલીસ મથકના ફુટેજથી પીઆઈ સીસીટીવી કેમેરાના ફૂટેજ ઓટો સામે થયેલા ડિલિટ થયા છે તે માની લઈએ આક્ષેપોને સ્પષ્ટ પરંતું 'લોકસત્તા-જનસત્તા'એ સમર્થન મળશે

શિક્ષક હુમલાનો અહેવાલ બીજા જ તેવું લાગતા દિવસે પ્રસિધ્ધ થતાં ડીએસપીએ પાર્ી આ ઈનો

બાપ્પાની આરાધના અને

સરકારના પ્રયાસોને સફળ બનાવીએ

માસ્ક પહેરી, સામાજિક અંતર જાળવી,

આવો મહામારીનું કરીએ વિસર્જન

ગુજરાત માટીકામ કલાકારી

(ગુજરાત સરકારની સંસ્થા સેક્ટર-૧૨, ગાંધીનગર

अने ३२व टेडनोवोश्च संस्थान

ગણેશ ઉત્સવની મજા માણીએ

સ્વચ્છતા સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખીએ અને

પ્રકૃતિનો છે સંદેશ, ઘરે-ઘરે માટીના ગણેશ

કારીગરો પાસેથી માટીની મૂર્તિ મેળવવાના સ્થળો

વાસણા, વાડજ, અડાલજ, શેરથા.

હરિનગર, લંબે હનુમાન રોડ

CIN: L16000GJ1955PLC067605

ફોન નં: (૦૨૬૫)૨૫૪૦૨૮૧

કમિશ્રર અને સચિવ.

કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ,

ગેઢકાવ સક્ટાક

આથી નોટિસ આપવામાં આવે છે કે:

શારૂ થશે:

કરી શકાય.

વધુ માહિતી માટે સંપર્ક કરો ૭૫૭૫૦ ૮૮૭૮૮,

સમય: સવારે ૯.૦૦ થી સાંજના ૭.૦૦ વાગ્યા સુધી

અમદાવાદ

વડોદરા

સુરત

: ગુલબાઈ ટેકરા, રામદેવનગર, જોધપુર ટેકરા, રાણીપ,

: સિંધવમાતા રોડ, ખંડેરાવ માર્કેટ, તરસાલી, મોહમ્મદ

હોડી બંગલા, અડાજણ, જહાંગીરપુરા, પાંડેસરા,

હરીચંપા, ડીંડોલી, નેમનગર, બમરોલી, પર્વત પાટીયા,

ગોલ્ડન ટોબેકો લીમીટેડ

રજિસ્ટર્ડ ઓફિસઃ દરજીપુરા, પો. આમલીચારા,

Website:www.goldentobacco.in

કપમી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ),

ઈ-મતદાનની માહિતી અને બુક ક્લોઝરની નોટિસ

૧. કંપનીની કપમી એજીએમ ગુરુવાર, ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૧, ના રોજ સવારે ૧૧:૦૦

વાગ્યે કંપની ની રજીસ્ટર્ડ કપમી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ), ઈ-મતદાનની

માહિતી અને બુક ક્લોઝરની નોટિસ ઓફિસે બનિયન પેરેડાઇઝ રિસોર્ટ, દ્રમાડ રોડ

ર. ઘી કંપનીઝ એક્ટ, ૨૦૧૩ ની કલમ ૯૧ ની જોગવાઈઓ મુજબ અને સિક્યોરિટીઝ

એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર

રિક્વાયરમેન્ટસ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ ના નિયમ ૪૨ દેઠળ, સભ્યોનું રજીસ્ટર અને

શેર ટ્રાન્સફર બુક્સ સપ્ટેમ્બર ૨૪, ૨૦૨૧ થી સપ્ટેમ્બર ૩૦, ૨૦૨૧ (બંને દિવસો

3. વાર્ષિક અદેવાલની ઈલેકટ્રોનીક કોપી કંપનીની વેબસાઇટ

www.goldentobacco.in પર ઉપલબ્ધ છે. વાર્ષિક અદ્વેવાલ અન્ય તમામ

સભ્યોને તેમના નોંધાયેલ સરનામાં પર પરવાનગી અપાયેલ પદ્ધતિ થી મોકલવામાં

૪. સપ્ટેમ્બર ૨૩, ૨૦૨૧ ના રોજ કટ ઓફ તારીખે ભૌતિક સ્વરૂપમાં (ફીઝીકલ)

અથવા ડિમટીરિચલાઈઝડ સ્વરૂપમાં શેર ધરાવતા સભ્યો, ઇલેક્ટ્રોનિક મેતદાન કરી

શકે છે, જે એજીએમના નોટિસમાં દર્શાવ્યા મુજબ સેન્ટ્રલ ડિપોઝિટરીઝ સર્વિસ

લિમિટેર્ડના ('સીડીએસએલ') ઇલેક્ટ્રોનિક વોર્ટિંગ સિસ્ટર્મ દ્વારા એજીએમ ના સ્થળ

સિવાયના સ્થળ પરથી કરી શકાશે. આથી બધા સભ્યોને જાણ કરવામાં આવે છે કે:

i. એજીએમ ની નોટીસમાં જણાવેલ વ્યવહારો માટે ઈલેકટ્રોનીક વોટીંગ કરી શકાશે;

ii. ઈ-વોટિંગ સોમવારે, સપ્ટેમ્બર ૨૭, ૨૦૨૧ ના રોજ (૯:૦૦ વાગ્ચે સવારે IST)

iii. ઇ-વોટિંગ બુધવાર, સપ્ટેમ્બર ૨૯, ૨૦૨૧ ના રોજ (૫:૦૦ વાગ્ચે સાંજે IST)

İV. ઇલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા અથવા એજીએમમાં મત આપવા માટેની લાયકાત નક્કી

V. બુધવાર, સપ્ટેમ્બર ૨૯, ૨૦૨૧ ના રોજ સાંજે પઃ૦૦ પછી ઇ-વોટિંગ મોડ્યુલને

Vi. કોઈપણ વ્યક્તિ જે વાર્ષિક અદેવાલ મોકલ્યા અદેવાલ મોકલ્યા બાદ કંપનીના

સભ્ય બન્યા હોય અને કટ ઓફ તારીખે શેર ધરાવતા હોય તે વ્યક્તિ નોટીસમાં

જણાવેલ ઈ -વોટીંગ ની સૂચનાઓને વાંચીને યુઝર આઈડી અને પાસવર્ડ મેળવી

શકે છે જે કંપનીની વેબસાઈટ www.goldentobacco.in અને

Vii. જે સભ્યો એ ઈ-વોટિંગ દ્વારા મતદાન કરેલ છે તેઓ મીટિંગમાં ભાગ લઈ શકે છે

પરંતુ મીટિંગમાં ફરીથી મત આપવા માટે હકદાર રહેશે નહીં. જેમણે ઈ -વોટીંગ કર્યુ

નથી તેવા મીટીંગ માં હાજર રહેનાર સભ્યો માટે મતપત્રક દ્વારા મતદાનની સુવિધા

પ. કોઈપણ પ્રશ્નોના કિસ્સામાં, તમે www.evotingindia.com ના વારંવાર

પૂછાતા પ્રશ્નો (FAQs) વિભાગનો સંદર્ભ લઈ શકો છો અથવા સીડીએસએલ, ૧૭મો

માળ, ફીરોઝ જીજીભોચ ટાવર્સ, દલાલ સ્ટ્રીટ, મુંબઇ - ૪૦૦૦૦૧ ને ટેલિફોન પર

૧૮૦૦૨૦૦૫૫૩૩, ઇમેઇલ આઈડી helpdesk.evoting@cdslindia.com

પર સંપર્ક કરી શકો છો. સભ્યો નીચે સહી કરનાર ને ઉપરોક્ત સરનામાં અથવા ઇમેઇલ

સીડીએસએલની વેબસાઇટ WWW.cdslindia.com પર ઉપલબ્ધ છે.

સીડીએસએલ દ્વારા બિનકાર્ચરત કરવામાં આવશે અને ત્યાર બાદ ઈ-વોટીંગ નહી

કરવા માટેની કટ-ઑફ તારીખ ગુરૂવાર, સપ્ટેમ્બર ૨૩, ૨૦૨૧ છે.

આવેલ છે. વાર્ષિક અહેવાલની રવાનગી ક સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ પૂર્ણ થઈ છે.

પાસે, વેમાલી, વડોદરા - ૩૯૦૦૦૮, ગુજરાત ખાતે ચોજાશે.

સિંદત) કંપનીના એજીએમના દેતું માટે બંધ રહેશે.

તળાવ, આજવા રોડ, ગોત્રીરોડ, માંજલપુર.

તુરંત તપાસનો આદેશ કર્યો બચાવવા માટે જ સીસીટીવીના બરોડા... હતો અને આદેશ બાદ આશરે ફુટેજ પુરાવમાં નથી જોડાયા અને એક મહિના સુધી સીસીટીવી અને જો આ વાત સાચી હોય તો ટેલ(દિનુ મામા) હાજર રહ્યા હતા કેમેરાના ફુટેજ સ્ટોરેજ થયેલા લાફા મારનાર પીઆઈની સાથે અને બરોડા ડેરીના મુદ્દે ફોર્મ્યુલા કોર્ટે ૨૦૨ મુજબ કોર્ટ હતા પરંતું આ બનાવની તપાસ માનવતા ભુલીને પીઆઈને મુજબ સમાધાન કરી લીધું હતું. ઈન્ક્વાયરીનો આદેશ કર્યો છે. કરનાર ડીવાયએસપી કલ્પેશ બચાવનાર ડીવાયએસપી કલ્પેશ આ પત્રકાર પરિષદમાં જિલ્લા આ કોર્ટ કાર્યવાહી દરમિયાન સોલંકીએ કયા કારણોસર સોલંકી પણ આ બનાવમાં એટલા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા, કેતન ઇનામદારના જે પ્રશ્નો છે જગદીશચંદ્રની પુત્રીએ આ સાથી મહત્વના પુરાવા ગણાય જ જવાબદાર છે અને તેમની સાંસદ રંજનબહેન ભટ્ટ પણ ઉપ એનું નિરાકરણ લાવવા માટે ઘટનામાં અતિમહત્વના મનાતા તેવા આ સીસીટીવી કેમેરાના સામે પણ ઉચ્ચાધિકારીએ પગલા સ્થિત રહ્યાં હતાં.

મુદ્દે ટેલએ ખાતરી આપી છે. બરોડા

Bharat Parenterals Limited

બરોડા ડેરીના પ્રમુખ દિનેશ ૫ જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ

CIN NO: L24231GJ1992PLC018237 **Registered Office & Works:** Iaripura, Ta. Savli, Dist. Vadodara - 391520 (Guj.) India. Tele : (02667)-251679, 251680, 251669, 99099 28332. E-mail: info@bplindia.in, Web.: www.bplindia.in (WHO-GMP CERTIFIED * STAR EXPORT HOUSE)

NOTICE is hereby given that 28th Annual General Meeting (AGM) of the Company will be held on Thursday September 30, 2021 at 01:00 P.M. through Video Conference ("VC") / Other Audio-Visual Means ("OAVM") to transact the business, as set forth in the Notice of the AGM.

1. In view of the continuing Covid-19 pandemic, the Ministry of Corporate Affairs ("MCA") has vide its Circular No. 14 dated April 8, 2020 read with Circular No. 17 dated April 13, 2020 and Circular No. 20 dated January 13, 2021 (hereinafter collectively referred to as "MCA Circulars") permitted the holding of AGM through VC or OAVM without the physical presence of Members at a common venue. In compliance with these MCA Circulars, Circulars issued by SEBI and the relevant provisions of the Companies Act, 2013 and the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, AGM of the Members of the Company will be held through VC/OAVM.

2. The Notice convening the 28th Annual General Meeting together with the Annual Report for F.Y. 2020-2021 is available on the website of the company www.bbilindia in and on the website of SES www.bseindia.com. The notice of the AGM is sent to the shareholders along with

NOTICE

the company $\underline{www.bplindia.in}$ and on the website of BSE $\underline{www.bseindia.com}$. The notice of the AGM is sent to the shareholders along with the link of Annual Report of FY 2020-2021 through electronic mode to those shareholders whose E-mails ID's are registered with RTA and the link of Annual Report of FY 2020-2021 through electronic mode to those shareholders whose E-mails ID's are registered with RTA and the link of Annual Report of FY 2020-2021 through electronic mode to those shareholders whose E-mails ID's are registered with RTA and the link of Annual Report of FY 2020-2021 through electronic mode to those shareholders whose E-mails ID's are registered with RTA and the link of Annual Report of FY 2020-2021 through electronic mode to those shareholders whose E-mails ID's are registered with RTA and the link of Annual Report of FY 2020-2021 through electronic mode to those shareholders whose E-mails ID's are registered with RTA and the link of Annual Report of FY 2020-2021 through electronic mode to those shareholders whose E-mails ID's are registered with RTA and the link of Annual Report of FY 2020-2021 through electronic mode to those shareholders whose E-mails ID's are registered with RTA and the link of Annual Report of FY 2020-2021 through electronic mode to those shareholders whose E-mails ID's are registered with RTA and the link of Annual Report of FY 2020-2021 through electronic mode to the RTA and the link of Annual Report of FY 2020-2021 through electronic mode to the RTA and the RTA a

Depositories.

The Company will be providing remote e-voting facility ("remote e-voting') to all its Members to cast their votes on all resolutions set out in the Notice of the AGM as well as the facility of voting through e-voting system during the AGM. Detailed procedure for remote e-voting/e-voting is provided in the Notice of the AGM. The E-voting period shall commence from 27th September, 2021 at 09:00 A.M. (IST) to 29th September, 2021 15:00 P.M. (IST). Remote E-Voting shall not be allowed beyond such period. In case of any queries, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com or call on toll free no.: 1800 1020 990 and 1800 22 44 30 or send request at evoting@nsdl.co.in.

The Register of Members & Share Transfer Register of the Company will remain closed from September 23, 2021 to September 29, 2021 (both days inclusive) for the purpose of Annual General Meeting.

In case of any query, clarification or grievances members may contact Ms. Lubhanshi Jhalani, Company Secretary, Survey No. 144& 146 Haripura, Savli, Vadodara-391520, Gujarat. Contact No. 9909928332, E-Mail-cs@bplindia.in.

By order of the Board For Bharat Parenterals Limited

भा३ थुनु नाभ

શેખ સાજીયાબાનું આરીફઇકબાલ હતું બદલીને નવું નામ

શેખ સાઝીયાબાનુ આરીફઇકબાલ

રાખેલ છે.

બી-૧૦૬, માસુમ ચેમ્બર્સ-૨,

પાણીગેટ, વડોદરા.

CHANGE OF NAME

I, Nayar Sarojini Radhakrishnan,

wife of No. 1076, Late major P

Radhkrishnan, I Change my name

from PAYARENGIP SAROJINI

To NAYAR SAROJINI

RADHAKRISHNAN due to

difference of name in Military and

Civil Record

Affid.: No. IN-GJ14873923317244T Dated: 04.09.2021

| KAUSHALKUMAR

BHAVINKUMAR

SHARMA Changed My

Name from SHARMA

KAUSHALKUMAR

BHAVINKUMAR

To KAUSHALKUMAR

BHAVINKUMAR SHARMA

and My father Name is

SHARMA and My mother

Name is **HEMLATABEN**

BHAVINKUMAR SHARMA.

અરજદારઃ ઓનીષ વિશ્વનાથ ભાઢીયા રહે; એલ-૬૦૧,કેબેસ્ટીયલ સીટીફેઝ-૧,રાવેત,કિથીલે, પુના

BHAVINKUMAR HIRABHAI | | ல்.

Lubhanshi Jhalani Company Secretory

INVOVATIVE

Place : Vadodara Date : 07th Septembar, 2021

INNOVATIVE TYRES & TUBES LIMITED CIN: L25112GJ1995PLC086579 Registered Office: 1201 1202 1203 GIDC Halol -389350, Panchmahals, Gujarat Tel.: (02676) 220621

Email: investors@innovativetyres.co.in;

NOTICE OF 26[™] ANNUAL GENERAL MEETING AND E-VOTING INFORMATION NOTICE is hereby given that the 26th Annual General Meeting (AGM") of the Members of Innovative Tyres & Tubes Limited will be held on Wednesday, September 29, 2021 at 9:00 A.M. (IST) through Video Conferencing ("VC")/ Other Audio-Visual Means ("OAVM") to transact the business as set out in the Notice of AGM.

The Company has sent the Notice of AGM and Annual Report, including the Audited Financial Statements for the Financial Year 2020-21, on September 6, 2021 through electronic mode to the shareholders whose e-mail ids are registered with the Company/ Registrar and Share Transfer Agent ("RTA") or with the Depository Participants in accordance with the General Circular Nos. 14/2020, 17/2020 and 20/2020 dated April 8, 2020, April 13, 2020 and May 5, 2020 respectively hereinafter collectively referred as ("MCA Circulars) issued by the Ministry of Corporate Affairs ("MCA") and Circular dated January 15, 2021 read with Circular dated May 12, 2020 issued by the Securities and Exchange Board of India ("SEBI"). The copy of the Annual Report and AGM notice is also available on the Company's Website at www.innovativetyres.com, websites of the stock exchange i. e. National Stock Exchange of India Limited-Emerge Platform at www.nseindia.com and website of Link Intime India Private Limited ("LIIPL") at https://www.linkintime.co.in. The dispatch of Notice of the AGM through e-mails has been completed on September 6, 2021

E-VOTING

Members are provided with a facility to attend the AGM through electronic platform provided by Company's Registrar and Share transfer Agent viz. LIIPL. Members are requested to visit https://instameet.linkintime.co.in and access the shareholders'/members' login by using the remote e-voting credentials provided to them. The documents pertaining to the items of business to be transacted in the AGM shall be available for inspection at

www.innovativetyres.com. Instructions for Remote e-Voting and e-voting:

- Pursuant to Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 as amended from time to time, and Regulation 44 of SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulation, 2015 the Members are provided with the facility to cast their votes on all the resolutions as set out in the Notice of AGM using electronic voting system ("Remote e-Voting") provided by LIIPL. Member's holding shares either in physical form or in dematerialized form, as on Wednesday, September 22, 2021 ("Cut-off date") can cast their vote through remote e-voting of LIIPL i.e. https://instavote.linkintime.co.in. A person whose name is recorded in the register of Members or in the Register of Beneficial Owner maintained by the Depositories as on the Cut-off date only shall be entitled to avail the facility of Remote e-Voting.
- The Remote e-Voting period will commence on Sunday, September 26, 2021 at 9.00 A.M. (IST) and ends on Tuesday, September 28, 2021 at 5.00 P.M. (IST). The Remote e-Voting module shall be disabled by LIIPL thereafter. Once the vote on a resolution is cast by the member, the member cannot modify it subsequently.
- Members who have acquired shares after the sending of the Annual Report through electronic means and before the Cut-off date may obtain the USER ID and password by sending a request at enotices@linkintime.co.in or investors@innovativetyres.co.in. However, if a person is already registered with LIIPL for remote e-voting then he/she may use the existing USER ID and Password and cast the vote.
- Members attending the AGM through VC/OAVM but who have not casted their vote by Remote e-Voting shall be eligible to cast their vote through e-Voting during the AGM (when window for e-voting is activated upon instructions of the Chairman). Members who have voted through Remote e-Voting shall be eligible to attend the AGM through VC/OAVM, however they shall not be eligible to vote at the meeting. Further the Members attending the AGM through VC/OAVM shall be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Act.
- The procedure of e-voting is provided in the Notice of the AGM as well as in the E-mail sen to the members by LIIPL. Please refer the e-voting user manual for members available in the downloads section of the e-voting websites of LIIPL i.e. https://instavote.linkintime.co.in. In case the shareholders have any queries or issues regarding e-voting, please refer the Frequently Asked Questions ("FAQs") and INSTAVOTE E-voting Manual available at https://instavote.linkintime.co.in under help section or write an e-mail to enotices@linkintime.co.in or call at Tel: 022-4918 6000.

Further, the Shareholders are also requested to refer to the Notice of the AGM for more details on process to be followed from their side, if any, in this regard.

BOOK CLOSURE

NOTICE is further given that pursuant to the provisions of Section 91of the Companies Act 2013 read with Companies (Management and Administration) Rules 2014 and Regulation 42 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Register of Members and the Share Transfer Books of the Company will remain closed from Thursday, September 23, 2021 to Wednesday September 29, 2021 (both days inclusive for the purpose of AGM.

> By order of the Board of Directors for Innovative Tyres & Tubes Limited

Date: September 7, 2021 Mukesh Desai તારીખઃ ૦૭-૦૯-૨૦૨૧ Chairman થળ : અમદાવાદ







સ્થળ ઃવડોદરા

તારીખ: ૦૮-૦૯-૨૦૨૧





તારીખ : સપ્ટેમ્બર ૭, ૨૦૨૧

સ્થળ : વડોદરા

share@goldentobacco.in પર પણ લખી શકે છે.

બોર્ડના આદેશ દ્વારા

પવનકુમાર માલસરીયા

સહી /-

ગોલ્ડન ટોબેકો લીમીટેડ

હોલ ટાઇમ ડાયરેક્ટર અને સીએફઓ